



MAN-002-001504

Seat No. _____

B. Com. (Sem. V) (CBCS) Examination

October / November – 2016

Principles of Auditing - I

(New Course)

Faculty Code : 002

Subject Code : 001504

Time : 2½ Hours]

[Total Marks : 70

સૂચના : (૧) દરેક પ્રશ્નોના જવાબ મુખ્ય ઉત્તરવહીમાં જ આપવાના રહેશે.
(૨) દરેક પ્રશ્નના ગુણ પ્રશ્નની જમણી બાજુ દર્શાવેલ છે.

- | | | |
|---|---|----|
| ૧ | (અ) ઓડિટિંગનો અર્થ અને મહત્વ સમજાવો. | ૧૦ |
| | (બ) “નામાપદ્ધતિ એક જરૂરિયાત છે, જ્યારે ઓડિટિંગ એક વૈભવ છે.” આ વિધાનની સત્યતા ચર્ચો. | ૧૦ |

અથવા

- | | | |
|---|---|----|
| ૧ | (અ) ઓડિટિંગના ફાયદા અને મર્યાદાઓ ચર્ચો. | ૧૦ |
| | (બ) ઓડિટિંગનું કાર્યક્ષેત્ર સમજાવો. | ૧૦ |
| ૨ | (અ) ચાલુ ઓડિટના ફાયદા અને ગેરફાયદાની ચર્ચા કરો. | ૧૦ |
| | (બ) ઓડિટ કાર્યક્રમ સમજાવો. | ૧૦ |

અથવા

- | | | |
|---|---|----|
| ૨ | (અ) ઓડિટ કાર્યક્રમ એટલે શું ? તેના ઉદ્દેશો જણાવો. | ૧૦ |
| | (બ) ઓડિટ નોંધપોથી સમજાવો. | ૧૦ |

- | | | |
|---|---|----|
| ૩ | આંતરિક અંકુશ એટલે શું ? આંતરિક અંકુશનાં લક્ષણો અને હેતુઓ જણાવો. | ૧૫ |
|---|---|----|

અથવા

- | | | |
|---|-------------------------------------|---|
| ૩ | (અ) પ્રસારિત મહેસૂલી ખર્ચાઓ સમજાવો. | ૮ |
| | (બ) આંતરિક ઓડિટનું મહત્વ સમજાવો. | ૭ |

- ૪ (અ) વાઉચિંગ એટલે શું ? વાઉચિંગ અંગે ઓડિટરની ફરજોની ચર્ચા કરો. ૮
- (બ) વાઉચિંગનાં લક્ષણો અને હેતુઓ જણાવો. ૭

અથવા

- ૪ (અ) મૂડી ખર્ચ અને મહેસૂલી ખર્ચ વચ્ચેનો તફાવત સમજાવો. ૭
- (બ) નીચેના પૈકી કોઈ પણ ચાર વ્યવહારોનું વાઉચિંગ કરો : ૮
- (૧) દેવીહૂડી નોંધ
- (૨) જાંગડ વેચાણ
- (૩) લેણીહૂડી નોંધ
- (૪) બાંયધરી કમિશન
- (૫) પ્રાથમિક ખર્ચ.

ENGLISH VERSION

- Instructions :** (1) Write answers of all the questions in main answer book.
- (2) Right side figures show marks of each question.

- 1 (a) Explain the meaning and importance of Auditing. 10
- (b) “Book keeping is a necessity, while auditing is a luxury.” Discuss the propriety of the statement. 10

OR

- 1 (a) Discuss merits and demerits of auditing. 10
- (b) Explain scope of auditing. 10
- 2 (a) Discuss the advantages and disadvantages of continuous audit. 10
- (b) Explain Audit Programme. 10

OR

- 2 (a) What is Audit Programme ? State its objectives. 10
- (b) Explain Audit Notes. 10

- 3** What is Internal Control ? Mention features and objectives of Internal Control. **15**

OR

- 3** (a) Explain Deferred revenue expenditure. **8**
 (b) Importance of Internal Audit. **7**
- 4** (a) What is Vouching ? Discuss the auditors duties regarding vouching. **8**
 (b) Mention the features and objectives of vouching. **7**

OR

- 4** (a) Explain difference between capital expenditure and revenue expenditure. **7**
 (b) Do the vouching of following transaction : (any **four**) **8**
 (1) Bills payable notes
 (2) Sales on approval
 (3) Bills receivable notes
 (4) Underwriting commission
 (5) Preliminary expenses.
-